

MFSL/SEC/EQ/2025/41

May 02, 2025

To,
The Manager,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers
Dalal Street
Mumbai – 400001

To,
General Manager
National Stock Exchange of India Limited
Exchange Plaza
Plot No. C/1, G Block
Bandra-Kurla Complex, Bandra (East)
Mumbai – 400051

Scrip Code: **540749, 947381**

Trading Symbol: **MASFIN**

Dear Sir,

Sub: Newspaper Advertisement of Audited Financial Results for the fourth quarter and year ended on March 31, 2025.

Pursuant to Regulation 47 and Regulation 52(8) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company has given Newspaper Advertisement in One (1) English - FREE PRESS GUJARAT and One (1) Regional Language Newspaper - Gujarati - LOKMITRA for Audited Standalone and Consolidated Financial Results for the fourth quarter & year ended on March 31, 2025.

Kindly take the same on your record.

Thanking you,
Yours faithfully,

For, **MAS Financial Services Limited**

Riddhi Bhaveshbhai Bhayani
(Company Secretary & Chief Compliance Officer)
Membership No.: A41206

Encl. As above

Regd. Office :

6, Ground Floor, Narayan Chambers,

B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380 009. www.mas.co.in

CIN : L65910GJ1995PLC026064

+ 91(O) 079 4110 6500 / 079 3001 6500

+ 91(O) 079 4110 6597, + 91 (O) 079 4110 6561

www.mas.co.in

mfsl@mas.co.in

Four Ahmedabad cousins drown in Kheda river, search on for two others

Ahmedabad, Four cousins from Ahmedabad's Naroda drowned in the Meshwa River near Kanij in Mahemdavad taluka of Kheda district on Wednesday evening. The deceased have been identified as Jinal, Divya, Falguni and

during a family meet-up when they were swept away by strong currents. The cousins started yelling for help after being carried away, according to the police. Locals instantly arrived at the location, but the group could not be saved.

Local authorities, including Mehmadaabad MLA Arjunsinh Chauhan, SP Rajesh Ghadiya, and District Collector Amit Prakash, are overseeing the rescue efforts.

Teams from the police and fire departments continue to comb the river in hopes of locating the missing individuals.

The group of six, all cousins, had entered the river

Temerario roars into India



Ahmedabad, Automobili Lamborghini marks a new milestone with the launch of the Temerario in India. Equipped with a revolutionary twin-turbo V8 hybrid powertrain, the Temerario delivers 920 CV and is the first production super sports car to achieve 10,000 rpm. Its performance is extraordinary: a top speed of 343 km/h (210+ mph) and 0-100 km/h (0-62 mph) in just 2.7 seconds. It is the second model in the Lamborghini's High-Performance Electrified Vehicle (HPEV) range to enter the Indian market. Following the launches of the two plug-in hybrid versions - the V12 HPEV, Revuelto, and the first plug-in hybrid Super SUV, the Urus SE - this marks the full completion of Sant'Agata

Bolognese's hybrid transition within the Direzione Cor Tauri strategy. Francesco

Scardaoni, Region Director of Automobili Lamborghini Asia Pacific, commented, "India remains one of the key markets for Lamborghini in the Asia Pacific region, and we are thankful to our customers for their enthusiasm and support, which led us to achieve record sales in the country in 2024. The Temerario features cutting-edge technology, including an all-new twin-turbo V8 engine, design and build in Sant'Agata Bolognese that delivers an outstanding 920CV, reaching an impressive 10,000 rpm and powered by three electric motors, it redefines performance, exhilarating driving dynamics and elevated comfort. (20-4

Caution to public against dealing on 'Opinion Trading Platforms'

Ahmedabad, It has come to the notice of Securities and Exchange Board of India (SEBI) that some platforms (known as 'Opinion Trading platforms') provide their users/participants a platform to trade/enter into arrangements wherein the payout is dependent on the outcome of a yes/no proposition of happening or not happening of the underlying event. In some cases, opinion trading platforms are designed in a manner so as to resemble an

investment platform as they use terminologies such as profits, stop loss, trading etc., terms closely associated with trades in securities. In view of the above, investors are advised to note that in general, opinion trading does not fall within regulatory purview of SEBI, as what is traded is not security. Investors/ participants should be aware that no investor protection mechanism under securities market purview shall be available for such investment/ participation. (20-4)

DAEWOO & MIL ANNOUNCE STRATEGIC ALLIANCE



Ahmedabad, Daewoo, the globally renowned brand known for its legacy of engineering excellence has officially entered the Indian automotive lubricant sector with a spectacular launch event held at Le Méridien, New Delhi. The launch marks a pivotal moment in the industry as Daewoo Lubricants now becomes available in India under a strategic licensing collaboration with Mangali Industries Limited, a trusted name in the Indian manufacturing landscape. Marking its official entry into the Indian automotive market, Daewoo Lubricants, launched its premium range of high performance lubricants designed for a wide variety of vehicles from two wheelers and

passenger cars to commercial and agricultural vehicles. With a legacy of engineering excellence and innovation, Daewoo is recognized for producing reliable, durable, user-friendly products as the brand sets a new benchmark in India's lubricant sector, offering world class quality tailored for Indian driving conditions. The high-profile event brought together leaders from the automotive and lubricant sectors, along with key stakeholders, to witness the signing and presenting of Licensee Certificate, while unveiling of Daewoo's premium range of lubricants, built to win the diverse driving conditions in India. (20-4)

54 years of Operation Searchlight: The dangers of rewriting the past in Bangladesh



attempt to erase his legacy.

Many of his statues were dismantled on first and second Independence days. His historical Dhanmondi residence was set on fire, while even the Mujibnagar Memorial, which marks the Proclamation of Independence on 11 April 1971, was vandalised. The violence was widespread—the systematic destruction targeted both cultural and political symbols of Bengali nationalism, sending a large message. The destruction of the Bangabandhu Memorial Museum and the defacement of his statues are alarming indicators of attempts to erase or rewrite significant aspects of Bangladesh's past.

The arts and cultural institutions also bore the brunt of this devastation. Cultural centres like Shilpakal Academy were vandalised and renowned artists including young film star Shanto Khan and his father were brutally killed. Moreover, today, efforts are underway to rewrite and alter literature and school textbooks. Furthermore, one of the most alarming aspects of this historical revisionism is also to strategically diminish the recognition of 'Operation Shantlight', whose anniversary is today.

All of these actions not only disrespect the legacy and contribution of the country's founding figures but also jeopardise the very foundations on which Bangladesh was built. If Bangladesh continues to whitewash its past, it risks losing its national identity and the ideals that gave it independence.


The current political turmoil in Bangladesh reflects this instability. The ongoing power struggle among various groups involving students, Bangladesh Jamaat-e-Islami (BJI), the army, Bangladesh Nationalist Party (BNP)

supporters, Awami League, Mohammad Yunus, and various other factions have created deep fractures within its society. While political elites continue to compete for power, ordinary citizens feel increasingly isolated and helpless. The Case for Incrementalism Furthermore, the interim government appears to be making rash, emotional decisions rather than pragmatic ones. Plans to drastically alter the constitution and introduce fundamental changes in

society reflect a reckless disregard for the delicate balance on which a society rests. Every society is the consequence of long-evolving conventions, traditions and practices that reflect collective national wisdom. When someone tries to alter everything at once, the entire social order risks collapsing. True progress is gained by incremental change rather than dramatic upheavals, a tenet firmly ingrained in conservative political thinking.

Furthermore, in revolutionary settings in which changes are introduced wholesale, it becomes extremely difficult to control and remediate any adverse implications that may develop. Furthermore, because of the rapid and violent character of the changes, the society that emerges from such a revolution is intrinsically flawed, riddled with new fault lines and perpetually teetering on the brink of further conflict and civil war. In contrast,

Incremental change makes it easier for society to react and deal with unexpected consequences. If a given reform does not operate as intended, it can be amended or repealed without causing widespread disruption to the society. This flexibility is absent in the aftermath of a revolution, where the sweeping changes made are often irreversible, leading to further marginalisation (of the most vulnerable), alienation of many, and prolonged instability. In such a scenario, despite the revolutionary harbinging class claiming lofty ideals, common people ultimately find that nothing has truly changed—only the ruling class has been replaced by a new one. Furthermore, the political leadership in Bangladesh must recognise that revenge politics only reinforces cycles of retribution. Today, the current ruling elites are dismantling their national identity and the legacy of the Awami League.



Branch Office: ICICI Bank Limited, 1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat- 395002.

PUBLIC NOTICE - TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET

[See proviso to Rule 8 (6)]
Notice for Sale of Immovable Asset(s)

This E-Auction Notice for Sale of Immovable Asset/ Assets is issued by ICICI Bank Ltd. (an underlying pool assigned to ICICI Bank by Devan Housing Finance Ltd. (DHFL) in relation to the enforcement of security with respect to a Housing Loan facility granted pursuant to a Loan Agreement entered into between DHFL and the following Borrower/ Borrowers/ Co-Borrower/ Co-Borrowers/ Guarantor/ Guarantors under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

The Notice is hereby given to the public in general and in particular to the Borrower/ Borrowers/ Co-Borrower/ Co-Borrowers/ Guarantor/ Guarantors that the below described immovable property mortgaged/ charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Ltd. will be sold on 'As is where is', 'As is what is' and 'Whatever there is' basis as per the brief particulars given below:

Sr. No.	Name of Borrower(s)/ Co-Borrower(s)/ Guarantor(s) Loan Account No.	Details of the Secured Asset/ Assets with the known encumbrances, if any	Outstanding amount	Reserve price per Earnest Money Deposit	Date and time of property inspection	Date and time of E-Auction
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	Vipendrakumar Budda Singh (Borrower) Shalu Ramlakhan Chouhan (Co-Borrowers) Loan A/c No. QZSUR00005040349	Plot No. 154, Ardhaa Dream Vibhag- 2, Opp. Jolva Gram Panchayat, Jolva Patiya Road, Jolva, Palansara, Surat- 394310. Admesuring Anarea of Plot Area 43.39 Sq.mtr., Construction Area 40.61 Sq.mtr., Undivided Portion Road And C.O.P. Area 23.61 Sq.mtr.,	Rs. 22,90, 198,33 /- as on 29-04-2025	Rs. 10,90,000/- Rs. 1,09,000/-	May 29, 2025 10:00 AM To 11:00 AM	June 07, 2025 From 11:00 AM Onwards

The online auction will take place on the website (URL Link-<https://disposalhub.com/>) of the E-Auction agency M/s NexGen Solutions Private Limited The recipients of this Notice are given a last chance to pay the total dues with further interest till June 06, 2025 before 04:30 PM failing which, the Secured Asset/ Assets will be sold as per schedule.

The prospective Bidder/ Bidders must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer to column E) at ICICI Bank/ ICICI Bank Limited, 1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat- 395002, on or before June 06, 2025 by 04:30 PM. Thereafter, he/ she/ they need to submit the offer/ offers through the website mentioned above on or before June 06, 2025 by 05:00 PM along with a scanned copy of the Bank acknowledged DD as a proof of payment of the EMD. In case, the prospective Bidder/ Bidders is/ are unable to submit the offer/ offers through the website then a signed copy of the tender documents may be submitted at ICICI Bank ICICI Bank Limited, 1st Floor, Geet Prabha Building, Near Nirmal Hospital Cross Road, Opp. Civil Hospital, Ring Road, Surat- 395002, on or before June 06, 2025 by 05:00 PM. The Earnest Money Deposit DD/ PO should be from a Nationalised/ Scheduled Bank in favour of 'ICICI Bank Limited' payable at Surat.

For any further clarifications regarding the inspection, Terms and Conditions of the E-Auction or submission of tenders, contact ICICI Bank Employee Phone No. 9099710771/ 7977863039.


Please note that Marketing agencies 1. ValueTrust Capital Services Private Limited, 2. Augoe Assets Management Private Limited, 3. Cardekho.com, 4. Hecta Proptech Private Limited, 5. ARCA E-Mart Private Ltd., have also been engaged for facilitating the sale of this property.

The Authorised Officer reserves the right to reject any or all of the bids without furnishing any further reasons. For detailed Terms and Conditions of the sale, please visit www.icicibank.com/n4p4s

Date: May 02, 2025
Place: Surat

Authorized Officer
ICICI Bank Limited

DAEWOO & MIL ANNOUNCE STRATEGIC ALLIANCE




Ahmedabad, Daewoo, the globally renowned brand known for its legacy of engineering excellence has officially entered the Indian automotive lubricant sector with a spectacular launch event held at Le Meridien, New Delhi. The launch marks a pivotal moment in the industry as Daewoo Lubricants now becomes available in India under a strategic licensing collaboration with Mangali Industries Limited, a trusted name in the Indian manufacturing landscape. Marking its official entry into the Indian automotive market, Daewoo Lubricants, launched its premium range of high performance lubricants designed for a wide variety of vehicles from two wheelers and

passenger cars to commercial and agricultural vehicles. With a legacy of engineering excellence and innovation, Daewoo is recognized for producing reliable, durable, user-friendly products as the brand sets a new benchmark in India's lubricant sector, offering world class quality tailored for Indian driving conditions. The high-profile event brought together leaders from the automotive and lubricant sectors, along with key stakeholders, to witness the signing and presenting of Licensee Certificate, while unveiling of Daewoo's premium range of lubricants, built to win the diverse driving conditions in India. (20-4)

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLICATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chamber, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLICATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad. Editor : Mayur C. Bhatt

Samsung's Premium AI-Integrated QLED TV Series



Ahmedabad, Samsung, India's largest consumer electronics brand, announced the launch of its new range of AI-powered QLED TV and Crystal Clear 4K UHD TV, available on Amazon, Flipkart, and Samsung.com starting May 1, 2025. Designed to deliver the ultimate home entertainment experience, the new lineup includes the QLED series - QE1, equipped with cutting-edge AI technology, and the Clear 4K UHD series - UE81, UE84, UE86, engineered to provide exceptional clarity, color, and detail for an immersive viewing experience. At the center of the launch is the QLED TV, featuring Real and Safe Quantum Dot Technology to deliver stunning color accuracy and durability. Featuring True Quantum Dots for unparalleled color precision, these TVs are also free from

Cadmium, a harmful substance known to be a cancer-causing agent, ensuring both safety and superior performance. Powered by Samsung's latest Q4 AI Processor, the TV analyzes and optimizes content in real-time with sharper visuals, clearer sound, and a more personalized viewing experience. Leveraging Samsung Vision AI, it intelligently enhances picture quality by recognizing scenes, objects, and faces for lifelike details, while also ensuring precise color volume with Pantone Validated Colors for true-to-life hues. To ensure peace of mind, the TV is secured with Samsung Knox Security, protecting users' data and connected devices. Additionally, the new lineup offers access to Endless Free Content, delivering a world of entertainment with no additional Cost. (20-4)

FINANCIAL SERVICES LIMITED
 Regd. Office: 6,Ground Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380 009.
 Phone No.: +91 79 41106500, Fax No.: +91 79 41106597, E-mail : riddhi_bhayani@mas.co.in, Website: www.mas.co.in
 CIN: L65910GJ1995PLC026064

Extract of standalone and consolidated audited financial results for the quarter and year ended March 31, 2025

Sr. No.	Particulars	Standalone			Consolidated		
		Quarter ended 31 March 2025 (Audited)	Quarter ended 31 March 2024 (Audited)	Year ended 31 March 2025 (Audited)	Quarter ended 31 March 2025 (Audited)	Quarter ended 31 March 2024 (Audited)	Year ended 31 March 2025 (Audited)
1	Total income from operations	416.51	329.31	1,517.19	437.63	346.96	1,595.97
2	Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	108.87	91.09	410.43	112.09	93.68	421.01
3	Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	108.87	91.09	410.43	112.09	93.68	421.01
4	Net profit / (loss) for the period after tax (after exceptional and / or extraordinary items)	80.82	68.05	305.93	83.41	70.10	313.98
5	Total comprehensive income for the period (comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax))	83.85	77.09	320.21	86.55	78.42	329.15
6	Paid up equity share capital	181.45	163.99	181.45	181.45	163.99	181.45
7	Reserve (excluding revaluation reserve)	2,404.35	1,604.97	2,404.35	2,469.02	1,654.58	2,469.02
8	Securities Premium Account	784.14	317.55	784.14	788.91	317.63	788.91
9	Net worth	2,585.80	1,768.96	2,585.80	2,650.47	1,818.57	2,650.47
10	Paid up Debt Capital/ Outstanding Debt	8,722.38	7,081.20	8,722.38	9,178.24	7,459.32	9,178.24
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-	-	-
12	Debt Equity Ratio (No. of times)	3.37	4.00	3.37	3.46	4.10	3.46
13	Earning per share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) - (not annualised for quarter)						
	1. Basic (₹)	4.46	4.15	17.23	4.55	4.23	17.48
	2. Diluted (₹)	4.46	4.15	17.23	4.55	4.23	17.48
14	Capital Redemption Reserve	Nil	Nil	Nil	NA	NA	NA
15	Debt Redemption Reserve	Nil	Nil	Nil	NA	NA	NA
16	Debt Service Coverage Ratio	NA	NA	NA	NA	NA	NA
17	Interest Service Coverage Ratio	NA	NA	NA	NA	NA	NA

Notes:

a) The above is an extract of the detailed format of audited financial results for the quarter and year ended March 31, 2025 which have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors in their meeting held on April 30, 2025, subjected to limited review / audit by the Statutory Auditors and filed with the Stock Exchanges under Regulation 33 and 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Results and pertinent disclosures related to other line items referred in the regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, are available on the websites of the Stock Exchanges at www.bseindia.com, www.nseindia.com, and on the website of the Company at www.mas.co.in.

b) The audited financial results of the Company have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Indian Accounting Standard ('Ind AS') 34 'Interim Financial Reporting' prescribed under Section 133 of the Companies Act, 2013 (the 'Act') read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India and in compliance with Regulation 33 and Regulation 52 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the 'SEBI Listing Regulations'). Any application guidance/ clarifications/ directions issued by Reserve Bank of India ('RBI') or other regulators are implemented as and when they are issued/ applicable.


For and on behalf of the Board of Directors of
Financial Services Limited

Sd/-

Kamlesh C. Gandhi

(Chairman & Managing Director)

(DIN - 00044852)



Place: Ahmedabad
 Date: 30 April 2025

પરમપૂજ્ય ધર્માચાર્ય મહંત શ્રી
અખિલેશ્વર દાસ જી મહારાજ,
(નરોડા) દ્વારા માનનીય ધારાસભ્ય
મંત્રીનાગર શ્રી અમુલ ભટ્ટની
ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં કર્યો.
આ અવસર પર શ્રી મારકાંત
ચતુર્વેદી (પેન્થર સિક્કોરિયાટી રૂ
એલાઈઝેસરિસીંગ) પણ ઉપસ્થિત
રહ્યા, જેમણે આ પહેલમાં પોતાનો
સહયોગ આપ્યો છે. સૌએ મળીને
યાત્રીઓની સેવા માટે આ વિનામૂલ્ય
કાષ્ટ્રના પાણીની સેવાને સંકળિતાપૂર્વક
શરૂ કરવામાં પોતાના યોગદાન

આપું.
સિસ્ટરન્ટ કોમર્શિયલ મેનેજર
શ્રી સંજય યાદવે શ્રી રાઘવ સેવા
સમિતિના આ પ્રયાસની પ્રશંસા
કરી. આ વિનામૂલ્યે ઠંડા પાણીની
સેવા આ મોટી સંસ્થાનો પર યાત્રીઓ
માટે એક મોટી સુવિધા સાબિત થશે.
વિશેષરૂપે ગરમીની ઋતુમાં જ્યારે
તાપમાન અત્યંત વધી જાય છે.
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ
યાત્રીઓની સુવિધા અને કલ્યાણ
માટે આ પ્રકારના અન્ય પગલાં લેવા
માટે કટિબદ્ધ છે.

અમદાવાદ, ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર ડિવિઝન પર મદાર-પાલનપુર સેક્ટરના જવાઈ બોધ-મોરી બેડા સ્ટેશનો વચ્ચે જિજ્ઞાસક હૃદય કિર્મી ૧૧૮/૩-૪ પર ઈઝક બોક્સ લોન્ચિંગ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે સાબરમતી-જ્યેષ્ઠપુર-સાબરમતી એક્સપ્રેસ ટૂન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે. ૦૧ અને ૦૨ ને ૨૦૨૫ ના રોજ જ્યેષ્ઠપુર થી દોડનારી ટ્રેન નં. ૧૪૮૨૧ ૧ જ્યેષ્ઠપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે. ૦૨ અને ૦૩ ને ૨૦૨૫ ના રોજ સાબરમતી થી દોડનારી ટ્રેન નં. ૧૪૮૨૨ સાબરમતી-જ્યેષ્ઠપુર એક્સપ્રેસ રદ રહેશે. ટ્રેનોના સ્લોપેજ, સંરચના, રૂટ અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ગરમીનો પ્રકોપ દીવસે ને દીવસે વધી રહ્યો છે ત્યારે તેની સામે રક્ષણ મેળવવા-શું-શું કરી શકાય તે અંગે જિલ્લા પંચાયત, અમદાવાદની આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાની કાળજી લઈ કેટલાક ઉપાયો અને પ્રાથમિક સતરની જાણકારીનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે. બોમે ગરમી તથા ગરમ હવા ઉત્પન્ન થાય ત્યારે તાપમાન અત્યંત ઘટા સતર પર પહોંચે છે અથવા ગરમી અને ભેજ સાથે મળે ત્યારે હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય છે. આ હિટ સ્ટ્રોકની અસર વધ્યો, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, તેમજ મજૂરી કામ કરનાર લોકોને વધુ અને જટિલી અસર કરે છે. હિટ સ્ટ્રોકની પરિસ્થિતી સર્જાય ત્યારે માથામાં દુખાવો થવો, પસેવો ના થવો, ચામડી લાલ, સૂકી અને ગરમ થવો, ઉલટી થવી, અસ્થિતિ અનુભવી, આંખો લાલ થવી જેવા લક્ષણો જોવા મળે છે. આ પ્રકારની પરિસ્થિતીથી બચવા પાણી વધુ પીવું જોઈએ, નાહવાનું પ્રમાણ વધાવવું જોઈએ, સંદેશ અને હલકા રંગના કપડા પહેરવા જોઈએ, બે કારમાં બેસાવું ટાળવું જોઈએ, તેમજ આછોલોલ અને કેફી પદાર્થોનું સેવન ન કરવું જોઈએ અને કામ વગર બહાર પાડા ન નિકળવું જોઈએ. જો વ્યક્તિ હિટ સ્ટ્રોકનો ભોગ બને તો તેણે સારવાર મળે ત્યાં સુધી ભોગ બનેલ વ્યક્તિને તેના પગ જમીનથી થોડા ઊંચા રહે તેને સુસુવાવવો, પંખાની સીધી હવા તેને શરીર પર આવે તે રીતે સુસુવાવવો, કમર પર તથા ગળાની નીચે ભીન કપડા, ટુવાલ, બરફ મુકવો તેમજ તેને ઠંડુ સાદુ પાણી પીવાવાનું રહેવું જોઈએ.



ખોખરા યુથ ફેડરેશન એ વિવિધ ભજનમંડળી ઓ ની મહિલાઓ ઓ એ એક જ સાડી માં સજ્જ થઈ ને રાષ્ટ્ર ના નામે વિવિધ ભજનો ની રમઝટ બોલાવી ભક્તો અને શ્રદ્ધાળૂ ઓ ને મંત્ર મુગ્ધ કરિયા હતા

નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ દવા આપવાની પ્રક્રિયાની સમીક્ષા કરવા નિયમનકારી સંસ્થા હેઠળજઈએ તમામ રાયનો અને કેન્સરામાં પ્રદેશો માં પૈઇનકિલર્સ, ન્યુટ્રીશન સંધિમેનેડ્સ અને ડાયબિટીસ વિરોધી દવાઓ સહિત માન્યતા ન થરાવતી ઓ ફિક્સડ ડોઝ ક્રીમીનેશન દવાના ઉત્પાદન, વેણાણ અને વિતરણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. તમામ રાયનો અને કેન્સરામાં પ્રદેશોના ડ્રગ ડોક્ટરીસને આવી ફિક્સડ ડોઝ ક્રીમીનેશન દવા (ફૂઢ) ને માન્યા

આપવાની પ્રક્રિયાની સમીક્ષા કરવા માટે પણ આદેશ અપાયો છે. આવી માન્યતામાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક્સ એક્ટ ૧૯૪૦ અને નિયમોની જોગવાઈનું કડક પાલન કરવાની પણ તાકીદ કરાઈ છે. ફૂઢ દવાઓ ભેલી હોય છે જે બાંધે છે તેથી લુખ ગ્રીવેટિવ ફાર્માસ્યુટિકલ ં-ગ્રેડિયન્ટ્સ (ઈ) નિશ્ચિત પ્રમાણમાં મિશ્રણ હોય છે.

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા ડો. રાજવ રુચંગેશ્વરે ૧૧ એપ્રિલે એક પત્ર પાઠવીને આ આદેશ આપ્યો હતો.

આ પત્રમાં કહેવાની યોગ્ય મંજૂરી વિના દેશમાં નવી દવાની વ્યાખ્યા હેઠળ આવતી ફૂઢ અવાગમોના વેણાણ માટેના ઉત્પાદન લાઈસન્સ આપવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રાયની ભેલી શરૂ કરવા સાપતી ઔથોરિટીઓ આવી ચિંતા સાથે સમયાંતરે અનેક ખોજો જારી કરવામાં આવ્યા છે. આમ છતાં રાયની લાઈસન્સ સાપતી ઔથોરિટીઓ બિનમાન્યતાપ્રાપ્ત એફડીસીના ઉત્પાદન અને માર્કેટંગને મંજૂરી આપે છે.

અમદાવાદ, શું તમે રોજ સફર કરો છો? જો તમારો જવાબ હા હોય તો આ બળ-બળતી ગરમીમાં ટ્રેડિક સિગ્નલ પર લાંબા સમય સુધી રોકાઈ રહેવામાં તમે પરેશાન તો થતા જ હશો. દિવસમાં તપતી ગરમી તમે તમે સહન કરો જ છો. તેની સાથે આકરો તકડો, પરણેલા, શરીરની દુર્બલ અને અજાઈઝોને લીધે થતી ખંજવાળ જેવી ગરમીઓની અન્ય સમસ્યાઓનો પછા તમારે સામનો કરવો પડે છે. ઉપકૂલ, ઈમાની મિષ્ટિએ પવિત્ર તરફથી ભારતનો મુખ્ય પ્રિકલી હીટ પાવડર અજાઈઝો માટે ડર્મેટોલોજિસ્ટ દ્વારા ભવામણ કારયેલ એક સમાધાન છે અને તે પણ "લીમડા અને તુલસી"ની બમણી શક્તિ છે. આ વર્ષની ગરમી માટે બ્રાન્ડે અમદાવાદમાં એક શાનદાર પહેલની શરૂઆત કરી છે. આ પહેલ માફતે આપા શહેરના મુખ્ય ટ્રેડિક સિગ્નલો પર અસ્થાયી શોસ

લગાડવામાં આવ્યાં છે. આનાથી લગાડવા મુસાફરો એટલે કે ખેરીડી કરવા નીકળેલા અને ઓફિસ જનારા લોકો, વિદ્યાર્થી, સાર્કલ, ટુન્ડીલર અને કાર ચલકોને જેથીથી રાહત મળે. આ શેડસ કંકત એક મહત્વના માટે જ લગાડવામાં આવે છે છતાં ઉનાળાની ભીષણ “બળ-બળતી ગરમી”થી થોડા સમય માટે જ પણ થોડી રાહત તો મળે છે. આ શેડસથી સુર્યનો સીધો પ્રકાશ ઓંખો પર પડતો નથી અને ડાઉનરોને પણ સ્પેષ ડેખાય છે જેથી થીજી ને સંભવને અંકેક શરૂ થાય છે. કાકાકા પરિસ્થિતિ પણ તૈયાર થાય છે. આ પહેલ હેઠળ અમદાવાદના ઉમિયા નગર કોસિંગમાં રીફ્રીજ ઓવરલોડ ટ્રેડિક્સ સિંગલ શેડ્સ લગાડવામાં આવ્યાં છે. ઉનાળાની આ મોસમમાં ભારતના કેટલાય રાજ્યોમાં ઉપસ્યાનો પર કેટલાય પગલાઓમાં આવી જ પહેલની શરૂઆત કરવામાં આવી છે. આ રાજ્યોમાં સામેલ છે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને દિલ્લી કે જ્યાં ઉનાળામાં તાપમાન સતત ૩૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે છે.

નવી દિલ્હી, ટાઈમ મેગેઝિને વર્ષ ૨૦૨૫ માં વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે. ભારતીય મૂળના રેશ્મા કેવલરામાણીની પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રેશ્મા અમેરિકન બાપોટેકનોલોજી કંપની વર્ટેક્સ ફાર્માસ્યુટિકલ્સના સીઈઓ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે આ યાદીમાં સામેલ થનાર તે એકમાત્ર ભારતીય છે. મુંબઈમાં જન્મેલી રેશ્મા માત્ર ૧૧

વર્ષની ઉંમરે પોતાના પરિવાર સાથે અમેરિકા ગઈ હતી. તે હાલમાં બોસ્ટનમાં રહે છે. તેમને જે શ્રેડિયા પુત્રો પછા છે. ૧૯૮૮માં, રશિયાએ જીર્મની યુનિવર્સિટીમાંથી જીવરત્વ આર્ટ્સમેડિકલ એજ્યુકેશન પ્રોગ્રામ પૂર્ણ કર્યો. આ પછી તેમને મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં ફેલોશિપ મળી. આ પછી, ૨૦૧૫ માં, તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી જનરલ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી. એક

ફિઝીશિયન તરીકે, તેમણે
મેસેન્જરી સ્ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ
બ્રિધમ અને મહિલા હોસ્પિટલ, અને
મેસેન્જરી સ્ટ્રસ્ટ આઈ એન્ડ ઈયર્સ
ઈન્સ્ટિટ્યૂટ અને MIT સહિત અને
મોટી હોસ્પિટલોમાં કામ કર્યું.
ત્યારબાદ તેમણે બાયોફામાં લેક્ટમ
પ્રવેશ કર્યો અને ૧૨ વર્ષથી વધુ સમય
સુધી એમેઝોન માટે કામ કર્યું.
રેશ્મા ૨૦૧૭ માં વર્ટીક્સમાં
જોડાઈ.

અમદાવાદ, પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને ઉપડો અને ત્રીજા દિવસે ૦૬:૦૦ કલાકે અમદાવાદ સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ અને દાનાપુર પહોંચશે.

વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન નડિયાદ, છાયાપુરી થવાવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ રતલામ, ઉર્જિન, સંત હિરદાશામ નગર, બીના, સાગર દમોહ, કટની મુઝારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છે.

અમદાવાદ સ્પેશિયલ (૧૪ ટ્રીપ્સ) - અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ ૬ મે ૨૦૨૫ સુધી અમદાવાદ થી દર ૦૮.૨૦ કલાકે ઉપડશે અને બીજા દિવસ દાનાપુર પહોંચશે. તેવી જ રીતે દેશના અન્ય સ્થાનોથી અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ૭ જુન ૨૦૨૫ સુધી દર બુધવારે દાનાપુર

ध्यावध-धांनापुरे-
न नंबर ०८४०७
रप थी १७ जून
गणवावे सवारें
से १८.०० कलाडे
नंबर ०८४०८
मे र०रप थी १८
थी २२:३० कलाडे



खिवकी, पांडत धा
स्टेशनो पर रोका
टायर, स्लीपर अ
ट्रेन नंबर ०८
पेसेन्जर रिजर्वेश
शु शुशे. ट्रेनोना
अंगे विगतवा:
enquiry.indianra

દયાલુ ઉપાધ્યાય, બક્સર અને આર. આ. ટ્રેનમાં એસી ર-ટાઇર, એસી ૩-જનરલ ક્લાસ ના કોચ હશે. ૨૦૭ માટે બુકિંગ ૦૨ મે ૨૦૨૫ થી સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર ચલાવન સમય, સ્ટોપેજ અને સંરચના માહિતી માટે, મુસાફરો www.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અધવાવાદ, ધાટોલોડિયા સ્થિત કેલોરેસક કપ્પચર સ્કૂલ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે પ્રી પ્રાયમરીથી ધોરણ ૯ સુધીની વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક સિદ્ધિઓને સન્માનિત કરવા માટે 'પ્રતિબુદ્ધ એવોર્ડ' સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં શૈક્ષણિક અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં ૧૮૦ થી વધુ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને સન્માન કરવામાં આવ્યું હતું. છઠ્ઠા ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રદર્શનમાં તેમની શ્રેષ્ઠતા બદલ 'પ્રતિબુદ્ધ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. દરેક શ્રેડના પ્રથમ આવનારને 'પ્રવીણ એવોર્ડ' આપવામાં આવ્યો હતો, જ્યારે સતત

જાણ વધુ સુધી શ્રેષ્ઠ અભ્યાસ કરવાનો
 'અધિપતિ પ્રવીણ એવો' આપવામાં
 આવી હતો. ક્ષિસ્ત એક નિયમિતતા
 સાથે સંપૂર્ણ હાજરી ધરાવતા
 વિદ્યાર્થીઓને 'નિત્યમ એવો' આ
 આપવામાં આવી હતો, અને સતત
 વધુ સુધી ૧૦૦% હાજરી જાળવી
 રાખનારને 'ઉદ્ઘૃષ્ટ નિત્યમ એવો'થી
 સન્માનિત કરવામાં આવ્યા હતા. આ
 વર્ષે સહ-સંસ્કૃતિ ક્ષેત્રોમાં સિદ્ધિઓ
 માટે એક નવી શ્રેણી શરૂ કરવામાં
 આવી હતી, જેમાં પ્રી-પ્રાથમિકથી
 ધોરણ ૮ સુધી અભ્યાસ સિવાય અન્ય
 વૃત્તિઓમાં ગ્રામીણ ધરાવતા
 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા,
 આ પ્રયાસ શિક્ષાના દ્વારા વિદ્યાર્થીઓના
 સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતાને વધુ
 મજબૂત બનાવે છે. (૧૯-૧)

<div> <div>  MAS FINANCIAL SERVICES LIMITED </div> <div> Regd. Office: 6,Ground Floor, Narayan Chambers, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380 009. Phone No.: +91 79 41106500, Fax No.: +91 79 41106597, E-mail : riddhi_bhayani@mas.co.in, Website: www.mas.co.in CIN: L65910GJ1995PLC026064 </div> </div>						
Extract of standalone and consolidated audited financial results for the quarter and year ended March 31, 2025						
(₹ in Crores)						
Sr. No.	Particulars	Standalone			Consolidated	
		Quarter ended 31 March 2025 (Audited)	Quarter ended 31 March 2024 (Audited)	Year ended 31 March 2025 (Audited)	Quarter ended 31 March 2025 (Audited)	Year ended 31 March 2025 (Audited)
1	Total income from operations	416.51	329.31	1,517.19	437.63	1,595.97
2	Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	108.87	91.09	410.43	112.09	421.01
3	Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	108.87	91.09	410.43	112.09	421.01
4	Net profit / (loss) for the period after tax (after exceptional and / or extraordinary items)	80.82	68.05	305.93	83.41	313.98
5	Total comprehensive income for the period [comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	83.85	77.09	320.21	86.55	329.15
6	Paid up equity share capital	181.45	163.99	181.45	181.45	181.45
7	Reserve (excluding revaluation reserve)	2,404.35	1,604.97	2,404.35	2,469.02	2,469.02
8	Securities Premium Account	784.14	317.55	784.14	788.91	788.91
9	Net worth	2,585.80	1,768.96	2,585.80	2,650.47	2,650.47
10	Paid up Debt Capital/ Outstanding Debt	8,722.38	7,081.20	8,722.38	9,178.24	9,178.24
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-	-
12	Debt Equity Ratio (No. of times)	3.37	4.00	3.37	3.46	3.46
13	Earning per share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) - (not annualised for quarter)	-	-	-	-	-
	1. Basic (₹)	4.46	4.15	17.23	4.55	17.48
	2. Diluted (₹)	4.46	4.15	17.23	4.55	17.48
14	Capital Redemption Reserve	Nil	Nil	Nil	NA	NA
15	Debtenture Redemption Reserve	Nil	Nil	Nil	NA	NA
16	Debt Service Coverage Ratio	NA	NA	NA	NA	NA
17	Interest Service Coverage Ratio	NA	NA	NA	NA	NA
Notes:						
a)	The above is an extract of the detailed format of audited financial results for the quarter and year ended March 31, 2025 which have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors in their meeting held on April 30, 2025, subjected to limited review / audit by the Statutory Auditors and filed with the Stock Exchanges under Regulation 33 and 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Results and pertinent disclosures related to other line items referred in the regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, are available on the websites of the Stock Exchanges at www.bseindia.com, www.nseindia.com, and on the website of the Company at www.mas.co.in.					
b)	The audited financial results of the Company have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Indian Accounting Standard ('Ind AS') 34 'Interim Financial Reporting' prescribed under Section 133 of the Companies Act, 2013 (the 'Act') read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India and in compliance with Regulation 33 and Regulation 52 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the 'SEBI Listing Regulations'). Any application guidance/ clarifications/ directions issued by Reserve Bank of India ('RBI') or other regulators are implemented as and when they are issued/ applicable.					
					For and on behalf of the Board of Directors of MAS Financial Services Limited	
					Kamlesh C. Gandhi (Chairman & Managing Director)	
Place: Ahmedabad Date: 30 April 2025					(DIN - 00044852)	



पावरग्रिड POWERGRID

नोटीस

- बीज अविनिमय, 2003-नं क्रम 79 (1) (अ) साधे वांयांवायां आवृती कलम 62 हेऊण अने सेन्ट्रल एलेक्ट्रिसिटी रेग्युलेशरी क्रमिशन (१५५५२२ अंकी क्रमिशने) रेग्युलेशन्स, 2023 ना नियमन 15 (1) (अ) अने रेग्युलेशन्स 23 हेऊण, सेन्ट्रल एलेक्ट्रिसिटी रेग्युलेशरी क्रमिशन (रेग्युलेशन्स) रेग्युलेशन्स-नाना निगमो अने वरिडा निगमो वांयांवायां आवृती अरखू-1 :- पश्चिम क्षेत्रां कोंकण-पुर्वा-मापुसा ट्रांसमिशन सिस्टम. अरखू-2 :- पश्चिम क्षेत्रां विंध्याचल स्टेट-२ ट्रांसमिशन सिस्टम, अरखू-3 :- पश्चिम क्षेत्रां गंधार क्षेत्र पावर स्टेशन स्टेट-१ नांवे संलग्गले ट्रांसमिशन सिस्टम माटे अरखू.
- एफोरेकत ट्रांसमिशन सिस्टमां लागूआव्णो छे: (1) मध्यप्रदेश पावर मेनेजमेंट कंपनी लिमिटेड, जखणपूर (२) छत्तीसगढ़ स्टेट पावर लिफ्टिङ्ग कर्पोरेशन्स लिमिटेड (रेडिफ्प) (३) गुजरात मेनेज्मेन्ट वरिडा निगम लिमिटेड, पंढरार, (4) वीज्वां निगम, गोंया सेंटर, पणज्, (5) महाराष्ट्र स्टेट एलेक्ट्रिसिटी लिफ्टिङ्ग कर्पोरेशन्स कंपनी लिमिटेड, मुंबई, (६) त्रिअंगनअरघरी बीज लिफ्टिङ्ग कर्पोरेशन्स लिमिटेड, सिल्वासा.
- ट्रिफिक विगिनो:

(३.१. लाभानो)

विटिशान नं.	संयन्तनी विगिनो	DOCO/ ECOD	३1.03.2024 ना सेरफ पय्वां कर्वायनी लिमन	2019-20	2020-21	2021-22	2022-23	2023-24
				बुधिंग आभासे सुभायेशे AFC				
विटिशान-1	संयन्तनी विगिनो	01.01.2003	14899.35	1796.70	1788.38	1798.03	2107.36	2404.11
विटिशान-2	संयन्तनी विगिनो	01.04.2000	63097.36	4208.83	4197.08	4186.90	4186.02	4255.42
विटिशान-3	संयन्तनी विगिनो	08.07.1996	24481.61	3330.67	3369.38	3394.48	3440.50	3549.66

(३.२. लाभानो)

विटिशान नं.	संयन्तनी विगिनो	DOCO/ ECOD	३1.03.2029 ना सेरफ पय्वां कर्वायनी लिमन	2024-25	2025-26	2026-27	2027-28	2028-29
				AFC				
विटिशान-1	संयन्तनी विगिनो	01.01.2003	15773.97	2175.37	2225.38	2288.30	2329.23	2348.13
विटिशान-2	संयन्तनी विगिनो	01.04.2000	65001.43	4014.65	4174.74	4563.41	4900.87	5027.30
विटिशान-3	संयन्तनी विगिनो	08.07.1996	27121.06	3640.33	3932.80	4078.02	4230.05	4314.27

- आ नोडिसे अनो टेरिडिना निर्वरिडा माटे कुरवायां आसुव्ती आसुव्ती नल अरख्दार-नी वेवसायेंत www.powergrid.in पावर टेरिडिना आसुव्ती आसुव्ती.
- अरख्ठमां समाविष्ट टेरिडिना निर्वरिडा माटेनी दरमासो पुर सूचुनो अने वांयांओ, छे श्रोदो डाय नो, लागूआव्ती सांतिन कोंकण पय्वां डाय सेक्रेटरी, सेन्ट्रल एलेक्ट्रिसिटी रेग्युलेशन्स क्रमिशन, 6६०, 7 मी अने ठामो माण, टावर बी, वर्ल्ड ट्रे सेन्टर, नोरोज्, नगर, नवी दिल्ली - 110029 ससास एलएव कुरवायां आसुव्ती. (अथवा अन्य सरनाम्य क्वां कर्मिनासुं कुराव्ण्यो आसुव्ती छे) आ नोडिसेना प्रकाशना ३० डिसेमरनी अदर अरख्दारो तेनी कोपरेटो ओडिसेना सरनामे ओक नलदर आसुव्ती.

रथान: गुजरात
तारीख: 25/04/2025

Sd/-
मुख्य जनल मेनेजर (वाणिज्यिक)

पावर ग्रिड कोर्पोरेशन्स ऑफी इन्डिया लिमिटेड

(आसत सरकारी एगिड)

रजिस्ट्रार ऑफीस: भी-२, सुपूर नं. २, सेक्टर-२८, गुजरात-१२२००१, (पूरियाण्).

कन्ट्रोल ऑफिस: ओ-२, गुपूर नं. २, सेक्टर-२८, गुजरात-१२२००१, (पूरियाण्).

www.powergrid.in | CIN: L40101NL198703038121

A MAHARATNA PSU